



MBJ-1601250201020300 Seat No. \_\_\_\_\_

**B. A. (Sem. II) (CBCS) Examination**

March / April - 2018

**Economics**

*(Principles of Economics - II)*

*(Elective - I) (New Course)*

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

- સૂચના : (૧) બધાજ પ્રશ્નોના ગુણ સરખા છે.  
(૨) આંતરિક વિકલ્પના આધારે બધા પ્રશ્નોના જવાબ આપો.

- ૧ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજાવી તેની મર્યાદાઓની ચર્ચા કરો. ૧૪  
અથવા  
૧ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો આંતરસંબંધ તપાસો. ૧૪
- ૨ ઘટતા મળતરનો નિયમ સમજાવો. ૧૪  
અથવા  
૨ સાધનોનાં મૂલ્યનિર્ધારણનો પ્રશ્ન શા માટે અલગ રીતે વિચારવામાં આવે છે ? ૧૪  
સમજાવો.
- ૩ “ઉત્પાદન સાધનોનો પુરવઠો સંપૂર્ણ કરતા ઓછો મૂલ્યસાપેક્ષ હોય ત્યારે ભાડું ૧૪  
ઉદ્ભવે છે.” સમજાવો.  
અથવા  
૩ શુમ્પીટરનો નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત સમજાવો. ૧૪
- ૪ કાર્યોનફો અને શુદ્ધ નફા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ૧૪  
અથવા  
૪ પેટી અને ઉદ્યોગ કદ વિકાસનાં લાભાલાભ સમજાવો. ૧૪
- ૫ ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે) ૧૪  
(૧) વાસ્તવિક ખર્ચનો ખ્યાલ.  
(૨) નાણાકીય ખર્ચનો ખ્યાલ.  
(૩) સ્થિર મળતરનો નિયમ.  
(૪) નફાનો અર્થ અને વ્યાખ્યા.

## ENGLISH VERSION

- Instructions :** (1) All questions carry equal marks.  
(2) Answer all the questions on the basis of internal option.

1 Explain the concept of opportunity cost with the help of illustration and discuss its limitations. 14

**OR**

1 Examine the inter-relations between marginal cost and average cost. 14

2 Explain the law of diminishing return. 14

**OR**

2 Explain why does the issue of price determination of factors of production is separately thought. 14

3 When the supply of the factors is less than perfectly elastic rent arises. Explain. 14

**OR**

3 Explain the innovation theory of profit by Schumpeter. 14

4 Clarify the difference between gross profit and net profit. 14

**OR**

4 Explain the advantages and disadvantages of expansions size of firm and industry. 14

5 Write short notes : (Any **Two**) 14

- (1) The concept of real cost.
- (2) The concept of monetary cost.
- (3) The law of constant return.
- (4) The meaning and definitions of profit.